



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



તા.૧૦/૦૯/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૫૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૬ કેસ કરી, ૪૩ વ્યક્તિઓને ઝડપી, ૨૨૫ લીટર દેશી દારૂ, ૧૪૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૨૦ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૦૦ બિયર ટીન, ૧ સ્ફૂટર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૮૪૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૬૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૭૬૧/૧૮

ચાંદખેડા: ઉત્તમભાઈ અરવિંદભાઈ પારેખ (રહે. સેતુ એમરલ્ડ મોટેરા) એ તા.૯/૯/૧૮ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે જાન્યુઆરી ૨૦૧૭ થી તા.૩૧/૩/૧૮ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી જયેન્દ્રભાઈ ઉર્ફે સુખાભાઈ નટવરભાઈ પંચાલ (રહે. કૃપા રેસીડન્સી બળીયાદેવ મંદિર સામે મોટેરા) એ ઉત્તમભાઈ પારેખને અમેરીકા જવાની તથા ગ્રીનકાર્ડ કાઢી આપવાની લાલચ આપી ઉત્તમભાઈ પારેખના તથા અન્યના ખાતામાથી રૂપિયા ૨૦,૨૫,૦૦૦/- લઈ આજદીન સુધી વિદેશ જવાની ફાઇલ કે ગ્રીનકાર્ડ નહી બનાવી આપી વિદેશ ન્યુ જર્સી પરિવાર સાથે ભાગી જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.એસ.ડાભી ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૭૬૨/૧૮

ઘાટલોડીયા: શશાંક મહેંદ્રસિંગ રોહડીયા (રહે. બ્રીજગંગા રેસીડન્સી સેલરાજ બંગ્લોઝ રામદેવનગર સેટેલાઇટ) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૯/૧૮ રાતના ૯/૩૦ થી તા.૯/૯/૧૮ કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન મેગાન્સ કોમ્પલેક્ષમા આવેલ સેમસંગ સ્માર્ટ કેફે આર.ચાણક્ય એન્ટર પ્રાઇઝ નામની દુકાનનું શટર ઉંચું કરી અજાણી વ્યક્તિ દુકાનમાંથી મોબાઇલ ફોન નંગ-૪૪,લેપટોપ નંગ-૧,ટેબલેટ નંગ-૪, હેડફોન નંગ-૧, અને જે.બી.એલ.કંપનીનું હેડફોન નંગ-૧ મળી કુલ રૂપિયા ૧૨,૯૮,૪૬૪/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.એન.પ્રસાદ ચલાવે છે.

સેટેલાઇટ: કિંજલભાઈ ધનવંતરાય મામતોરા (રહે. ટાગોરપાર્ક સોસોયાટી નહેરુનગર સર્કલ પાસે સેટેલાઇટ) એ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૭/૯/૧૮ રાતના ૧૧/૧૫ થી તા.૯/૯/૧૮ કલાક ૭/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના મકાનનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાની દાગીના તથા રોકડ રૂપિયા તથા વિદેશી ડોલર મળી કુલ કિંમત રૂપિયા ૧,૮૦,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જી.પરમાર ચલાવે છે.

રામોલ: પ્રમોદભાઈ નટવરભાઈ વાઘેલા (રહે. પુષ્પવિહાર ડુપ્લેક્ષ અદાણી સર્કલ સામે રામોલ રીંગ રોડ) એ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૯/૧૮ બપોરના ૩/૦૦ થી તા.૯/૯/૧૮ બપોરના ૨/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનની બારીની ગ્રીલ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી ચાંદીની પાચલ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- અને રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.બી.વાઘેલા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૭૬૩/૧૮

ઇસનપુર: દિવ્યેશભાઈ દિનેશભાઈ ભાવસાર (ઉ.વ.૨૦) (રહે. શક્તિનગર સોસાયટી લાલ બંગલા પાછળ ગોવિંદવાડી ઇસનપુર) એ તા.૯/૯/૧૮ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૯/૧૮ રાતના ૧૦/૦૦ થી તા.૪/૯/૧૮ કલાક ૫/૩૦ વાગ્યા દરમ્યાન ઇસનપુર શક્તિનગર સોસાયટીના નાકે પાર્ક કરેલ પોતાના સ્ક્રટરની ડેકી ખોલી ડેકીમાંથી રોકડ રૂપિયા ૩૫,૦૦૦/- તેમજ જરૂરી કાગળોની અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વાચ.જી.માથુકીયા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૭૬૪/૧૮

નરોડા: ભારતીબહેન ભુદરભાઈ મકવાણા (રહે.એચ.એમ.માન્સુરીની ચાલી હરિઓમ ડેરીની સામે સુતરના કારખાના નરોડા) એ અગમ્ય કારણસર તા.૯/૯/૧૮ સવારના ૧૧/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે લોખંડની પાઈપ સાથે નાયલોનનો પટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી યોગેશભાઈ સેમ્યુલભાઈ ચલાવે છે.

ગોમતીપુર: ચિરાગભાઈ મનોજભાઈ સોલંકી (ઉ.વ.૨૮) (રહે.કેશાબલ્લુની ચાલી નગરી મીલ સામે ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૮/૯/૧૮ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચૌધરી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.